

માર્ચ 14, 2018

બ્રામ્પટનના સ્પોર્ટ્સ હોલ ઓફ ફેમમાં (પ્રખ્યાત રમતવીરોની ટ્રોફીઓ દર્શાવતા હોલમાં) ચાર નવા સભ્યો ઉમેરવામાં આવશે

બ્રામ્પટન, ઓન્ટેરિયો – બ્રામ્પટન સ્પોર્ટ્સ હોલ ઓફ ફેમ વર્ષ 2018 માં ચાર નવા સભ્યોને સમાવશે.

બિલ્ડર (બોડી બિલ્ડર - ખડતલ સ્નાયુબદ્ધ વ્યક્તિની) શ્રેણીમાં, પાવર-લિફ્ટર હરનેક સિંહ રાયે (Harnek Singh Rai) એક સ્પર્ધક, આયોજક, કોચ અને રેફરી તરીકે રમતગમતમાં આપેલા ફાળા બદલ તેમને સમાવવામાં આવશે. રોઝમેરી મિલર (Rosemary Miller) ને પણ બિલ્ડર તરીકે બ્રામ્પટનમાં ટેનિસ પ્રત્યે તેણીએ સમર્પિત કરેલા પોતાના વર્ષો બદલ, અને 55+ રમતોને પ્રોત્સાહન આપવામાં તેણીની આગેવાનીની કદર કરવા માટે તેણીને સમાવવામાં આવશે. એથલીટ (રમતવીર) શ્રેણીમાં, માર્ક વીવર (Mike Weaver) NHL (નેશનલ હોકી લીગ)માં વિતાવેલા 16 વર્ષ સહિત, પોતાની હોકી કારકિર્દી માટે યશસ્વી થશે. રિચાર્ડ સોસ (Richard Souce) ને એમેચ્યુર (અવેતન રમતવીર) અને પ્રોફેશનલ બોક્સર તરીકે તેમની સફળતાને બિરદાવવા હોલ ઓફ ફેમમાં એક એથલીટ તરીકે જોડવામાં આવશે.

38 મી એન્યુઅલ બ્રામ્પટન સ્પોર્ટ્સ હોલ ઓફ ફેમ ઈન્ડક્શન સેરેમની (સમાવેશ સમારંભ) મંગળવાર, મે 15 નાં રોજ રોજ થિયેટર, બ્રામ્પટનમાં યોજાશે. કોકટેલ ડિનર સાંજે 6 વાગ્યે શરૂ થશે જેના પછી ઈન્ડક્શન સેરેમની અને રિસેપ્શન (સન્કાર સમારંભ) યોજવામાં આવશે. આ વર્ષના પ્રસંગમાં મુખ્ય વક્તા ભૂતપૂર્વ CFL ક્વાર્ટરબેક અને ચાર-વખત ગ્રે કપ ચેમ્પિયન, ડેમોન એલેન (Damon Allen) રહેશે.

ટિકિટો હવે વેચાણ માટે રોજ થિયેટર બોક્સ ઓફિસ પરથી ટિકિટ દીઠ \$55 નાં દરે ઉપલબ્ધ છે. 12 વર્ષ અને ઓછી ઉંમરના બાળકો માટે ટિકિટનો દર \$27.50 છે, અને બે વર્ષથી ઓછી ઉંમરના બાળકોને પ્રવેશ મફતમાં આપવામાં આવે છે. ટિકિટ ખરીદવા, વેબસાઈટ www.rosetheatre.ca જુઓ અથવા 905.874.2800 નંબર પર ફોન કોલ કરો.

બ્રામ્પટન સ્પોર્ટ્સ હોલ ઓફ ફેમ અને આ વર્ષમાં સમાવાના સભ્યો વિશે વધુ માહિતી મેળવવા, બ્રામ્પટન સ્પોર્ટ્સ હોલ ઓફ ફેમની વેબસાઈટ www.brampton.ca/bshf જુઓ.

શું તમે આપણાં શહેરમાં રમતગમતમાં ઉત્કૃષ્ટ ફાળો આપનાર કોઈ વ્યક્તિથી માહિતગાર છો? [વર્ષ 2019 માટેનું નોમિનેશન ફોર્મ ડાઉનલોડ કરો!](#) આગામી વર્ષે હોલ ઓફ ફેમમાં સમાવાના સભ્યો માટેના નામાંકનો જૂન 15, 2018 સુધીમાં સ્વીકારવામાં આવશે.

બ્રામ્પટન સ્પોર્ટ્સ હોલ ઓફ ફેમની સ્થાપના વર્ષ 1979 માં સીટી ઓફ બ્રામ્પટન સાથે સંયુક્તપણે, રમતો માટે ઉત્સાહિતોના એક સમર્પિત સમૂહ દ્વારા કરવામાં આવી હતી. તે પાવરેડ સેન્ટરમાં, કેનેડી રોડ પર, સ્ટીલ્સ એવન્યુની દક્ષિણે સ્થિત છે.

અવતરણો (ક્વોટ્સ):

“બ્રામ્પટન આ વર્ષે સમાવવાના સ્પોર્ટ્સ હોલ ઓફ ફેમ સભ્યોમાં ગૌરવ લઈ શકે છે. આ સભ્યોએ પોતપોતાને સંબંધિત રમતોમાં દરેકે આપેલા ફાળાને આ શહેર અને દુનિયાભરમાં અનુભવવામાં આવે છે. કાઉન્સિલ અને બ્રામ્પટન સ્પોર્ટ્સ હોલ ઓફ ફેમ કમિટી વતી, અમને તેઓની ઉપલબ્ધિઓને ઓળખ અપાવવામાં ખુશી થાય છે.”

- મેયર લિન્ડા જેફ્રી (Linda Jeffrey)

“જેમ કે દરેક વ્યક્તિ જોઈ શકે છે, વર્ષ 2018 ની શ્રેણી રમતોની વિશાળ હારમાળાને પ્રતિબિંબિત કરે છે અને તેઓ સૌ આ પ્રતિષ્ઠિત આદર મેળવવાને બહુ લાયક છે. આ નવા સમાવેલા સભ્યોને આવકારવા એ અમારા માટે ખુશીની વાત રહેશે જ્યારે તેઓ ભૂતકાળમાં સમાવેલા તમામ સભ્યોની સાથે સાથે પોતાનું સ્થાન લેશે.”

- ડીન મેક્લોડ (Dean McLeod), અધ્યક્ષ - બ્રામ્પટન સ્પોર્ટ્સ હોલ ઓફ ફ્રેમ કમિટી

-30-

બ્રામ્પટનમાં મોટા પાયે ફેરફારો થઈ રહ્યાં છે. આપણે વેધક ધ્યાન કેન્દ્રિત કરતા ભવિષ્ય માટે તૈયાર સંસ્થા છીએ. આપણે આપણાં સમુદાયની વૃદ્ધિ જાણીએ છીએ, જુવાની અને વિવિધતા આપણને અલગ અલગ કરે છે. આપણે કેનેડાના નવીન શોધ કરતા સુપર કોરિડોરના કેન્દ્રમાં સ્થિત, રોકાણ પ્રોત્સાહક અને આપણી વૈશ્વિક સફળતા વિકસાવનાર છીએ. આપણે કંપાયમાન શહેરી કેન્દ્રો વિકસાવીએ છીએ જે તક પ્રજ્વલિત કરે છે અને અહીં રહેતા અને કાર્યરત લોકોમાં ગૌરવ રેડીએ છીએ. આપણે બ્રામ્પટનને આગળ વધારી રહ્યાં છીએ જે તેને નવીનતમ, સર્વગ્રાહી અને જુરસામય શહેર બનાવે. અમને [Twitter](#) અને [Facebook](#) પર અનુસરો. www.brampton.ca પર વધુ માહિતી જાણો.

મીડિયા સંપર્ક (MEDIA CONTACT)

નાટાલી સ્ટોગડિલ (Natalie Stogdill)

મીડિયા કોર્ડિનેટર (Media Coordinator)

સીટી ઓફ બ્રામ્પટન (City of Brampton)

905.874.3654 | natalie.stogdill@brampton.ca